

PRESSURE SENSITIVE SYSTEMS (INDIA) LIMITED

CIN: L90002GJ1987PLC143792

**Registered Office Address: -441 Block-C 1-1 TPS-14 Sumel-II Indian Textile Plaza, Shahibaug
Ahmadabad-380004, Gujarat, India**

Email ID: -pressuresensitive@gmail.com, Website: --www.pressuresensitivesystems.in;

Phone: +91 9978311249

Date: 18/11/2024

The Manager

The BSE Limited

25th Floor, PJ Towers,

Dalal Street Fort,

Mumbai-400 001

**SUB: NEWSPAPER PUBLICATION OF FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 30th
SEPTEMBER, 2024**

REF: PRESSURE SENSITIVE SYSTEMS (INDIA) LIMITED

SECURITY ID: PRESSURS, SECURITY CODE: 526773

Dear Sir/Ma'am,

Pursuant to the provisions of Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are pleased to enclose herewith a newspaper copy of financial results for the quarter ended on 30th September, 2024 published in "Financial Express" (English) and "Ahmedabad Express" (Gujarati) newspaper dated 17th November, 2024 as required under Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

You are requested to take the same on record and acknowledge the receipt.

For, PRESSURE SENSITIVE SYSTEMS (INDIA) LIMITED

ANJALI NAIR

DIRECTOR

DIN: 08620386

IDFC FIRST Bank Limited

(erstwhile Capital First Limited, amalgamated with IDFC Bank Limited...)

NOTICE UNDER SECTION 13 (2) OF THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002

Table with columns: Sr No., Loan No., Type of Loan, Name of Borrower, Date of Notice, Outstanding amount as per Notice

Date: 17.11.2024 Place: Vadodra

Advertisement for IDFC First Bank Limited with a woman's portrait and text: 'I arrive at a conclusion not an assumption. Inform your opinion with detailed analysis.'

ASSET RECOVERY MANAGEMENT BRANCH Bank of India Building, First Floor, 28, S. V. Road, Andheri (W), Near Andheri West Railway Station, Mumbai - 400 058. Tel No. - 26210406, 07, Email: asset.mn@bankofindia.co.in

EAUCTION FOR SALE OF IMMOVABLE PROPERTIES

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6 (2) of the Security Interest (Enforcement) Rules, 2002.

Table with columns: Sr. No., Names of the Account / Borrower / Guarantor, Description of the Properties, Reserve Price / EMD, Minimum Bid Increment, G/A Quota, G/A Dues, Cessal Security Interest Asset Id, Date/Time of sale on site, Contact No.

Terms and Conditions of the E-auction are as under: E-Auction is being held on "AS IS WHERE IS" basis, "AS IS WHAT IS BASIS" and "WHATSOEVER THERE IS BASIS" and will be conducted "On Line".

- Step 1: KYC Verification: Bidder to upload requisite KYC documents. KYC documents shall be verified by e-auction service provider.
Step 2: KYC Verification: Bidder to upload requisite KYC documents. KYC documents shall be verified by e-auction service provider.
Step 3: Transfer of EMD amount to the global EMD wallet.
Step 4: Bidder to Step 3 should be completed by bidder well in advance, before e-auction date.

Table with columns: Name, E-mail Id, Team, Mobile No. Helpline Number: support.ebrkay@psballiance.com

- 1. Intending bidders shall hold a valid e-mail address, for further details and query please contact eBRKay Helpline Number: 8291220020 Helpline e-mail ID: support.ebrkay@psballiance.com
2. To the best of knowledge and information of the authorized officer there is no encumbrances on the properties. However, the intending bidders should make their own independent inquiries regarding the encumbrances, title of the properties put on auction and claimants/creditors affecting the property, prior to submitting their bid.
3. The successful bidder shall be deemed to constitute any commitment or any representation of the Bank. The property is being sold with all the existing and future encumbrances whether known or unknown to the bank.

POSSESSION NOTICE (IMMOVABLE PROPERTY)

Whereas the undersigned being the Authorized Officer of the Bank of Baroda under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (2002) and in exercise of powers conferred under Section 13(2) of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated 06/09/2024 calling upon the Borrowers Mrs. Girishambai Hanishbhai Patel, Co-borrower Mr. Chiragbhai Ramnabhai Patel & Guarantor Mr. Nayan Kumar Ramnabhai Patel to repay the amount mentioned in the notice being Rs. 32,59,871.954/- Rupees Thirty two lakhs fifty nine thousand eight hundred seventy one and paise ninety five and interest thereon w.e.f. 05.09.2024 within 60 days from the date of receipt of the said notice.

Description of the Immovable Property: Equitable Mortgage of all the pieces and parcels of residential Row House No 2 measuring 1767.00 sq.fta (164.21 Sq.Mts.) along with construction made thereon having super built up area, constructed on Plot No. 9, Survey No. 942 and C.S. No. 1095 and 1097 Situated at 'Yog Park' Killa Para Tal. Ahmed. Valad. District. Vadodra. Gujarat. Hareeshbhai Patel Boundaries. On the East- Property of Sonu Dhanraj Z. On the West- Internal Road, On the North- Row House No. 1. On the South- Row House No. 3.

Date: 13/11/2024 Place: Vadodra

POSSESSION NOTICE (SECTION 13(4)) (For Immovable Property)

Whereas the undersigned being the authorized officer of the Bank of Baroda under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (2002) and in exercise of powers conferred under Section 13(4) of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated 31/08/2024 calling upon the borrowers Mr. Kanayyalal Dhanjibhai Rathod (Borrower) & Mr. Mayur Kanayyalal Rathod (Co-Borrower) & Mrs. Vanshika Kanayyalal Rathod to repay the amount mentioned in the notice being Rs. 15,57,940/- Interest Rupees Fifteen Lacs Fifty Seven Thousand Nine Hundred Forty Eight Only Interest Reversal plus Unpaid interest and other charges within 60 days from the date of receipt of the said notice.

Description of the Immovable Property: All the rights, title and interest of the immovable property i.e. Flat No. A-2/507, on S/507 measuring super built up area and area of the plot, is equivalent to 42.30 sq. mts. built up area 648.83 sq. feet, i.e. 60.28 sq. mts. and carpet area 539 sq. ft. i.e. 55.09 sq. mts., of building 'A' of 'Meera Residency' along with undividable share in its underground land on agriculture land for residential purpose bearing R. S. No. 46/1, block No. 72 park adjoining 627/2, mts., T.P. Scheme No. 23 (Kosad), T.P. No. 25, measuring 4391 sq. mts., of Village: Kosad, Tal.: Adajan (Former Surat City) Dist.: Surat, North: A-1 Wing Building, South: Ad. Nat. A-2/505, East: Open Land, West: Open Passage Flat No. A-2/506. Security Agreement: The above mentioned property was mortgaged with Bank of Baroda through an 'Instrument of Deposit of Title Deed' dated 07-04-2022 bearing registration number 11723 registered with the office of Sub-Registrar, Surat-4 (Katangam), Surat. CERASUD: 40006065157.

Date: 15.11.2024 Place: Surar

NEW NARODA BRANCH (24551) Shro No.8-15 R S No. 448/2, Basant Bahar Residency, New Naroda, Ahmedabad-382330

GOLD LOAN AUCTION SALE NOTICE

The undersigned persons are hereby informed that they have failed to pay off the liability in the loan accounts. Notices have been sent to them by Registered Post. They are therefore requested to pay off the liability and other charges and redeem the pledged securities on or before 11.11.2024 failing which the said securities will be sold by the Bank in public auction at the cost of the borrower at the Bank's premises between 02.30 PM to 04.30 PM on 22.11.2024 on any other convenient date thereafter without further notice of the said date of the auction.

Date: 15.11.2024 Place: Ahmedabad

BEDIPARA BRANCH

POSSESSION NOTICE (For Movable / Immovable Property)

Whereas the undersigned being the Authorized Officer of the Central Bank of India, Bedipara Branch under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (2002) and in exercise of powers conferred under Section 13 (2) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice Dated 03.08.2024 calling upon the Borrower M/S Ruvra Enterprise (Proprietorship Firm), Proprietorship Firm through its Borrower / Guarantor / Mortgagee, namely Mr. Dhawalji Maharajgosi Goswami (Borrower) and Mr. Sanjayji Maharajgosi Goswami (Guarantor / Mortgagee) to repay the amount mentioned in the notice being Rs. 66,82,846/- (Rupees Sixty Six Lakh Sixty Two Thousand Eight Hundred Forty Six Only) within 60 days from the date of receipt of the said notice.

Table with columns: Sr. No., Description of the Secured Assets / Immovable Property / Movable Property, Details of Mortgage Deed document, Date of Notice

Date: 15.11.2024 Place: Rajkot

PRESSURE SENSITIVE SYSTEMS (INDIA) LIMITED

Regd. Office: 441, BLOCK-C, 11 TPS 14, SUMEL 11 INDIAN TEXTILE PLAZA, Shahibag, Ahmedabad, Ahmedabad City, Gujarat, India, 380004

EXTRACT OF UNAUDITED STANDALONE FINANCIAL RESULT FOR THE QUARTER ENDED ON SEPTEMBER 30, 2024

Table with columns: Particulars, Quarter ended on 30/09/2024, Year ended on 30/09/2023, Quarter ended on 30/09/2024, Year ended on 30/09/2023

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULT FOR THE QUARTER ENDED ON SEPTEMBER 30, 2024

Table with columns: Particulars, Quarter ended on 30/09/2024, Year ended on 30/09/2023, Quarter ended on 30/09/2024, Year ended on 30/09/2023

Date: November 14, 2024 Place: Ahmedabad

Sale Notice For Sale Of Immovable Properties E-Auction Dt. : 10.12.2024

Regional Office : Surat District Region, 6th Floor, Baroda Sun Complex, Ghod Dod Road, Surat-395007, Phone No : 0261-2294631 E-mail : recovery.suratdist@bankofbaroda.com

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6 (2) & 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s), Mortgagee (s) and Guarantor (s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, possession of which has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis for recovery of dues in below mentioned accounts. The details of Borrower/s/Mortgagee/Guarantor/s/Secured Asset/s/Dues/Reserve Price/EMD and Bid Increase Amount are mentioned below -

Table with columns: Sr. No., Branch, Name of Borrower / Mortgagee, Property Description, Assets Type, Total Dues (In Lakh), Reserve Price (In Rs.), EMD (In Rs.), Status of Possession, Contact for Property Inspection

Statutory 15 Days Sale Notice For Under Sarfaesi Act To Borrower / Guarantor / Mortgagee | Last Day of EMD Submission 10.12.2024 till 5 : 00 PM. Minimum Bid Incremental Amount Rs. 10,000/- (Rs. Ten Thousand Only) | Inspection Start Date : 18.11.2024

For detailed terms and conditions of sale, please refer visit to the website link https://www.bankofbaroda.in/e-auction.htm and online auction portal https://ebkay.in. Also, prospective bidders may contact the Authorised officer on Tel. No. 0261-2294631.

Date: 16/11/2024 (In The Event Of Any Discrepancy Between The English Version And Any Other Version Of This Auction Notice, The English Version Shall Prevail) Authorised Officer, Bank of Baroda



